

ત્વરિત જાહેરાત માટે

## સિટી ઓફ બ્રેમ્પટન વરિષ્ઠ સલાહકાર, આર્થિક સશક્તિકરણ અને અશ્વેત વિરોધી રંગભેદ (Economic Empowerment and Anti-Black Racism) ઘોષીત કરે છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (19 જૂન 2020) – આજે, ગિવનેથ ચેપમેન સિટી ઓફ બ્રેમ્પટનના તાજેતરમાં જાહેર કરવામાં આવેલ અશ્વેત આફ્રિકન અને કેરિબિઅન સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સશક્તિકરણ અને અશ્વેત રંગભેદ વિરોધી યુનિટના વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જેની મંજૂરી સિટી કાઉન્સિલ દ્વારા 10 જૂન 2020ના રોજ આપવામાં આવી હતી.

શ્રીમતિ ચેપમેન મુખ્ય વહીવટી અધિકારીની કચેરીને અહેવાલ સોંપશે અને તેઓ ઉપરોક્ત યુનિટને મદદ કરશે અને તેને દોરશે તથા બ્રેમ્પટનમાંથી અશ્વેત વિરોધી રંગભેદને નાબૂદ કરવા માટેની કાર્ય યોજનાનો વિકાસ કરશે. સ્થાનિક સમૂદાયના હિસ્સાધારકોના માર્ગદર્શન હેઠળ કાર્ય મુખ્યત્વે બ્રેમ્પટનના અશ્વેત સમાજની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિસ્થિતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

શ્રીમતિ ચેપમેનનો સામાજિક પ્રવૃત્તતા, હિમાયત અને સંચારનો લાંબો અનુભવ સિટી અને સમાજ માટે અતિ ઉપયોગી નીવડશે કારણકે તેણી કર્મચારીગણ, અને સ્થાનિક વ્યવસાયો અને હિસ્સાધારકો સાથેના વ્યવહારોમાં મુખ્ય ભૂમિકા ભજવશે. હજુ તાજેતરમાં જ શ્રીમતિ ચેપમેન કેનેડિયન બ્લેક કોલસમાં પ્રમુખ રહી ચુક્યા છે જ્યાં તેણીએ યુથ નટવર્કને પ્રેરિત કર્યા અને તેમનું સશક્તિકરણ કર્યું હતું તેમજ યુ મિડિયા પ્રોડક્શન-સને પ્રેરણા આપી હતી. એક દયાળુ સામાજિક અગ્રણી તરીકે શ્રીમતિ ચેપમેને CTV અને CityTV સહિત ટેલિવિઝન પર પણ દીર્ઘકાળ કાર્ય કરી ચુક્યા છે જ્યાં તેણીએ ગુણવત્તાયુક્ત સશક્તિકરણ કરતા કાર્યક્રમોનું નિર્માણ કર્યું હતું જે અશ્વેત સમાજને અંકિત કરતા હોય.

ટોરોન્ટોના આફ્રિકન અશ્વેત કેનેડિયન સમાજના યુવાઓ સાથે માર્ગદર્શક તરીકેનો અને સામાજિક વ્યવહાર બાંધવાનો શ્રીમતિ ચેપમેનનો દીર્ઘકાલીન અનુભવ રહ્યો છે. શ્રીમતિ ચેપમેન 100 પરિપૂર્ણ બ્લેક કેનેડિયન મહિલા પુરસ્કાર (Accomplished Black Canadian Women Award) અને પ્રોફેશનલ અસોસિએશનનો વિમેન ઓફ ઓનર પુરસ્કાર (Women of Honour Award) તેણીના સામાજિક યોગદાન માટે પ્રાપ્ત કરી ચુક્યા છે અને સાથે જ તેણીના સમકક્ષોએ તેણીને કમ્યુનિટી સર્વિસ એન્ડ મિડિયાના ક્ષેત્રમાં 2008 ની સાલમાં હેરી જિરોમ એવોર્ડ માટે નામાંકિત કર્યા હતાં. 2013 માં શ્રીમતિ ચેપમેનને કમ્યુનિટી સર્વિસ માટે કિવન એલિઝાબેથ II ડાયમંડ જુબિલી મેડલથી નવાજવામાં આવ્યા હતાં.

સિટી જેમ જેમ અશ્વેત આફ્રિકન અને કેરિબિઅન સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સશક્તિકરણ અને અશ્વેત વિરોધી રંગભેદ યુનિટનો વિકાસ કરશે ત્યારે વધુ જાણકારી મેળવવા માટે અને તેમાં સામેલ થવામાં પોતાનો રસ દર્શાવવા મહેરબાની કરી સિટીનો સંપર્ક અહીં કરો [AntiBlackRacismUnit@brampton.ca](mailto:AntiBlackRacismUnit@brampton.ca). આ એક અગત્યની પહેલ છે જે મુખ્ય વહીવટી અધિકારીની કચેરી દ્વારા મેયર કાઉન્સિલરો તેમજ સમૂદાયના હિસ્સાધારકોનો સહયોગ મેળવીને ચલાવાશે.

આ પ્રક્રિયામાં સમાજ પોતાનો મત પ્રકટ કરે અને જણાવે તે માટેની તકો નજીકના ભવિષ્યમાં જાહેર કરવામાં આવશે.

**અવતરણો**

"આપણે આપણા ઈતિહાસમાં એક એવા વળાંક પર આવી ચુક્યા છીએ જ્યાં આપણે આપણા તમામ સમાજોને અશ્વેત વિરોધી રંગભેદનો સામનો કરતા જોઈ શકીએ છીએ. જાહેર હોદ્દાઓ તરીકે અમે સ્વીકાર કરીએ છીએ કે અમારી એવા અર્થપૂર્ણ પગલાં લેવાની ફરજ છે જે વાસ્તવિક પરિવર્તન તરફ દોરી જાય. અમે શ્રીમતિ ચેપમેન સાથે તેમજ બ્રેમ્પટનના પહેલવહેલા અશ્વેત આફ્રિકન અને કેરિબિઅન સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સશક્તિકરણ અને અશ્વેત રંગભેદ વિરોધી યુનિટ સાથે કાર્ય કરવા ઉત્સુક છીએ જેથી આપણા શહેરમાં વાસ્તવિક સમાનતાનું સર્જન થઈ શકે."

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"શહેર તરીકે અમે જાણીએ છીએ કે અમારી મોટી જવાબદારી છે કે અમારું કાર્ય બ્રેમ્પટનના વૈવિધ્યસભર સમાજને મદદરૂપ થાય અને તેનો ખરો ચહેરો વ્યક્ત કરે. શ્રીમતિ ચેપમેન ઊંડા ઉત્તરેલા અશ્વેત વિરોધી રંગભેદ સામે કાર્ય યોજનાનો વિકાસ કરવામાં તેમજ એવી સંસ્કૃતિ અને સમાજની રચના કરવામાં અગ્રેસરની ફરજ બજાવશે જે સમાવેશીત હોય, કારણસભર હોય અને સમાનતાનું આરોપણ કરે."

- ડેવિડ બાર્રિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સીટી ઓફ બ્રેમ્પટન

"મને સીટી ઓફ બ્રેમ્પટન સાથે સહયોગ કરતા આનંદની લાગણી થાય છે જેઓએ સમાજમાં રંગભેદ સામે સક્રિય અભિગમ અપનાવ્યો છે. હું આ શહેરના કર્મચારીઓ, કાઉન્સિલ અને સ્થાનિક સમુદાય સાથે ભેગા મળીને કાર્ય કરી, નેતૃત્વની તકને સાર્થક કરવા ઉત્સુક છું જેમાં મારો બહોળો અનુભવ કામે લગાવી શકું જેથી બ્રેમ્પટનમાં રંગભેદ સામે અસરકારક લડત આપી શકાય અને તે નાબૂદ કરી શકાય. આપણે માટે જરૂરી છે કે પોતિકાપણની ભાવના લાવી શકીએ. આપણે આપણા નાગરિકોમાં રહેલ વાણશોધાયેલ સંભાવનાઓને સ્વીકારવી જ રહી, અર્થપૂર્ણ પરિવર્તનમાં તેમની યોગદાન આપવાની ભાવનાની કદર અને શહેરના ઘાતાંકીય વિકાસમાં યોગદાન આપવાની તક આપવી જ રહી. જમાના વીતી ગયા કે તેજસ્વી, કંઈક નવતર કરવાની ભાવના સેવતા, અતિ મહેનતુ અશ્વેત કેનેડિયન પ્રજા જેઓ ઘણું બધું પ્રદાન કરી શકે તેમ છે, તેઓને માત્ર તેમની ત્વચાના રંગને આધારે અવગણીને બાકાત રાખવામાં આવ્યા છે. હવે બહુ થયું, આમ થતું બંધ થવું જ જોઈએ! એક મહાન શહેરના નિર્માણ માટે આપણે તમામ નાગરિકોનું સશક્તિકરણ કરવા પ્રતિબદ્ધતા દાખવવાની છે. હવે બસ થયું, હવે એવા કોઈ સમૂહ રહેવા ના જોઈએ જેઓ પછાત રહે."

- ઝિવનેથ ચેપમેન, વરિષ્ઠ સલાહકાર, આર્થિક સશક્તિકરણ અને અશ્વેત વિરોધી રંગભેદ (Economic Empowerment and Anti-Black Racism), સીટી ઓફ બ્રેમ્પટન

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ



## Media Release

છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ.  
અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

### મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)